

-: અખબારી યાદી:-

વન્યપ્રાણી સંરક્ષણ બાબતે જાગૃતિ કેળવાય તે હેતુ આધુનિક ઝૂ ઇન્ટરપ્રિટેશન સેન્ટર (મુલાકાતી માહિતી કેન્દ્ર) તૈયાર કરવામાં આવેલ

તારીખ: ૨૯-૧૧-૨૦૨૧

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન મુજબ આધુનિક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે અસંખ્ય મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૨૫ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વધુમાં ઝૂ ખાતે વન્યપ્રાણી સંરક્ષણ બાબતે જાગૃતિ કેળવાય તે હેતુ આધુનિક ઝૂ ઇન્ટરપ્રિટેશન સેન્ટર (મુલાકાતી માહિતી કેન્દ્ર) તૈયાર કરવામાં આવેલ છે.

હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી ૫૭ પ્રજાતિઓનાં કુલ ૪૫૬ વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયાઈ સિંહ, સફેદ વાઘ, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા, હિમાલયનાં રીંછ, સ્લોથ રીંછ, જળ બિલાડી, ચાર પ્રકારનાં શ્વાનકુળનાં પ્રાણીઓ, ચાર પ્રકારનાં વાંદરાઓ, વિવિધ પ્રજાતિઓનાં સાપ, બે પ્રકારની મગર, જુદી જુદી પ્રજાતિઓનાં હરણો તથા વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વિગેરેને આધુનિક પાંજરાઓ બનાવી મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરી વન્યપ્રાણીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે. આ ઉપરાંત મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓને પર્યાવરણ અંગે માહિતી મળી રહે અને વન્યપ્રાણી સંરક્ષણ બાબતે જાગૃતિ કેળવાય તે હેતુ આધુનિક ઝૂ ઇન્ટરપ્રિટેશન સેન્ટર (મુલાકાતી માહિતી કેન્દ્ર) તૈયાર કરવામાં આવેલ છે. જેમાં વન્યપ્રાણી-પક્ષીઓનાં લાઇફ સાઇઝ મોડેલ્સ, ઇન્ટરેક્ટીવ એક્ટીવીટી તથા વિવિધ માહિતી દર્શાવતી પેનલ્સ પ્રદર્શિત કરવામાં આવે છે. ઝૂ ઇન્ટરપ્રિટેશન સેન્ટરની પ્રવેશ ફી રૂ.૧૦/- તથા પ્રવાસે આવતા શાળા-કોલેજના બાળકો માટે રૂ. ૫/- નિયત કરવામાં આવેલ છે. આ સેન્ટરને જોઇને મુલાકાતીઓ ખુબજ પ્રભાવીત થાય છે અને ખુબ જ સારા રીવ્યુ મળી રહ્યા છે. છેલ્લા ૦૨ (બે) માસ દરમિયાન ઝૂ ઇન્ટરપ્રિટેશન સેન્ટર ખાતે કુલ ૨૬,૧૯૩ મુલાકાતી પધારતા રાજકોટ મહાનગરપાલિકાને રૂ.૨,૫૮,૮૪૦/-ની આવક થયેલ છે. આ ઇન્ટરપ્રિટેશન સેન્ટરમાં નીચેની વિગતે થીમ આધારીત જુદા જુદા પ્રદર્શન કક્ષ બનાવવામાં આવેલ છે.

(૧) પ્રાણીસંગ્રહાલય કક્ષ: આ કક્ષમાં પ્રાણીસંગ્રહાલયનો ઇતિહાસ, વર્તમાન વિકાસ, પ્રદર્શિત વન્યજીવો, મુલાકાતી સુવિધાઓ અને ભાવી વિકાસ અંગેની માહિતી રજુ કરેલ છે. આ ઉપરાંત ઝૂ વેટરનરી હોસ્પિટલ તથા વન્યપ્રાણીઓ માટેનો આઇશોલેશન વોર્ડ વિગેરેને પ્રતીકૃતી રૂપે પ્રદર્શિત કરવામાં આવે છે.

(૨) ગિર ઇકો સિસ્ટમ: આ કક્ષમાં ગિર-ગિરનાર વૃક્ષો, વન્યપ્રાણી-પક્ષીઓ અને ગિર પરિસર અને ગીર વિસ્તારનાં માલધારીઓની જીવનશૈલી, નેસ વિગેરેને પ્રતીકૃતી રૂપે પ્રદર્શિત કરવામાં આવે છે.

(૩) સસ્તન વર્ગનાં પ્રાણીઓ: આ કક્ષમાં ભારતના જુદા જુદા અભયારણોમાં જોવા મળતા સસ્તન વર્ગનાં (બચ્ચાને જન્મ આપતાં) વન્યજીવોની જાતિ, જીવન, વર્તણુક અને જંગલમાં તેઓનું મહત્વ વિગેરેને પ્રતીકૃતી રૂપે પ્રદર્શીત કરવામાં આવે છે.

(૪) પક્ષીજગત: આ કક્ષમાં પાણીકાંઠાના પક્ષીઓ, વન-વગડાના પક્ષીઓ, શીકારી પક્ષીઓ તથા ઘાસીય મેદાનના પક્ષીઓ વિગેરેને તેઓના રહેઠાંણ, વર્તણુક અને જંગલમાં તેઓનું મહત્વ વિગેરેને પ્રતીકૃતી રૂપે પ્રદર્શીત કરવામાં આવે છે.

(૫) સરીસૃપ વર્ગ: આ કક્ષમાં પેટે ઘસડાઇને ચાલતા જુદી જુદી સરિસૃપ પ્રજાતીઓના પ્રાણીઓ જેવા કે વિવિધ સાપ, મગર, ઘરીયલ, કાયબા, ઘો, ગરોળી વિગેરેને તેઓના રહેઠાંણ, જીવન, વર્તણુક અને જંગલમાં તેઓનું મહત્વ વિગેરેને પ્રતીકૃતી રૂપે પ્રદર્શીત કરવામાં આવે છે.

(૬) કચ્છ ઇકો સિસ્ટમ: આ કક્ષમાં કચ્છનાં રણમાં જોવા મળતા કાંટાળા વૃક્ષો, વન્યપ્રાણી-પક્ષીઓ, ભારતીય ધુડખર, સુરખાબ પ્રજનન પરિસર, કચ્છ વિસ્તારનાં અગરિયાઓનાં જીવનશૈલી, ભૂંગા વિગેરેને પ્રતીકૃતી રૂપે પ્રદર્શીત કરવામાં આવે છે.

(૭) એજ્યુકેશન કક્ષ: આ કક્ષમાં પ્રકૃતિ શિક્ષણ શિબિર અંતર્ગત આવતાં શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓને વન્યપ્રાણી સૃષ્ટિ અને પર્યાવરણ લગત વિવિધ ફિલ્મ-શો બતાવવામાં આવે છે. આ ઉપરાંત શાળા-કોલેજના વિદ્યાર્થીઓને પ્રાણી સંગ્રહાલયની ઉપયોગીતા, વન અને વન્યપ્રાણીઓનું પર્યાવરણની દ્રષ્ટીએ મહત્વ તેમજ લોકોને વન્યપ્રાણી સંરક્ષણ અને સંવર્ધનમાં કેવી રીતે જોડી શકાય વિગેરે બાબતોની માહિતી તજજ્ઞો દ્વારા પ્રેઝન્ટેશન/લેકચર સ્વરૂપે આપવામાં આવે છે.

પ્રતિ

તંત્રીશ્રી,

ઉપરોક્ત અખબારી યાદી જાહેર જનતાના લાભાર્થે આપના અખબારમાં વિના મુલ્યે પ્રસિધ્ધ કરવા વિનંતી.

ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ
રાજકોટ મહાનગરપાલિકા